

# ખેડૂતોનું ફૂલિધામ



## બટાટાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ



ડૉ. મનીષ વી. પટેલ

ડૉ. આર. એ. પટેલ

શ્રી બી. કે. પટેલ



## કૃષિ વિજ્ઞાન કેન્દ્ર

ગણપત ચુનિવર્સિટી

મહેસાણા ડિસ્ટ્રીક્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન, જી. મહેસાણા

ફોન - ફેક્સ : (૦૨૭૯૨) ૨૮૬૧૮૮

- શાકભાજુનો રોકડીયો પાક
- એકમ વિસ્તારમાંથી ઘણું કરતા ૭ ઘણું, ડાંગર કરતાં ૮ ઘણું, મકાઈ કરતા ૧૧ ઘણું ઉત્પાદન વધુ મળે છે.

**જમીનની તૈયારી :**

આગલા પાકના જડીયા વીણી, બે થી બ્રાન હિંડી ખેડ કરી જમીન તૈયાર કરવામાં આવે છે. જમીનની ફળદૂપતા જળવાઈ રહે તે માટે સારુ કહોવાચેલું છાણીચું ખાતર ૨૫-૩૦ ટન અને એક ટન દિવેલી ખોળ હેક્ટારેમાં નાખી જમીન ખેડી લેળવી દેવું.

**વાવણી સમય :**

બટાટાનો પાક તાપમાન ઉપર આધારિત હોઈ તેનું વાવેતર ૧૫ મી નવેમ્બરની આજુભાજુ કરવું હિતાવહ છે. વધુ વધેલું કે મોકું વાવેતર કરવાથી ઉત્પાદન ઓછું મળે છે.

**બિયારણની પસંદગી :**

સારી ગુણવત્તા ધરાવતું રોગમુક્ત બિયારણ પસંદ કરવું જોઈએ. બલારના રાજ્યોમાંથી જ્યારે બીજ લાવવાનું થાય ત્યારે તે બટાટાના બીજ જન્ય રોગો જેવા કે કોમન સ્કેલ, ચાઠાના રોગ તથા ઝંગડીના રોગથી મુક્ત હોવું જોઈએ.

૧. બટાટાની જાત વધારે ઉત્પાદન આપતી હોવી જોઈએ.

૨. રોગ અને શુષ્વાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવી જોઈએ.

૩. કંદનો રોગ, ચમક અને આકાર સારા હોવા જોઈએ.

૪. પસંદ કરેલ જાતની સંગ્રહ શક્તિ સારી હોવી જોઈએ.

● આ હેતુનું દ્વારા લઈ નીચેની જાતો પસંદ કરવી.

૧. કચીયારા માટે : કુફરી પુંખરાજ, કુફરી અશોકા, કુફરી સતલજ

૨. ફેન્ય ફાઈંગ માટે : કુફરી ચંદ્રમુખી, ચોચ. ટી. ૬૨-૬૨૧

૩. ટગલા પદ્ધતિથી સંગ્રહ કરવા માટે : કુફરી બાદશાહ, કુફરી આનંદ, કુફરી જવાહર, કુફરી બહાર, કુફરી સતલજ, જે. ડબલ્યુ-૧૯૦

૪. પ્રોસેસોંગ માટે : કુફરી રિય્સોના-૧, કુફરી ચંદ્રમુખી, કુફરી લોકર, કુફરી જ્યોતિ, કુફરી એટલાન્ડીક

૫. બટાટાની કાપણી પછી સીધા વેચાણ માટે : કુફરી બાદશાહ, કુફરી પુંખરાજ, કુફરી સતલજ

**બીજનો દર :**

● વાવણી માટે ૧ હેક્ટારે ૨૫૦૦ થી ૩૦૦૦ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

● બિયારણનો આખા કંદનો વાવણી માટે ઉપયોગ કરો.

● બિયારણના રૂકડા રૂપ થી ૪૦ ગ્રામ વજનના કરવા જોઈએ.

● બટાટા કોલ સ્ટોરેજમાંથી કાટયા બાદ ૭ થી ૮ દિવસ પછી તેની આંખો જુવારના દાણા જેવડી થાય ત્યારે વાવણી કરવી જોઈએ.

● એક હેક્ટાર વાવેતર માટેના બટાટાના રૂકડાને વાવણી પહેલાં મેન્કોગ્રેલ ૧ કિલો દવા સાથે ૫ કિ.ગ્રા. શંખજુરનું મિશ્રણ કરી દવાની સુકી માપજત આપવી. જેવી બટાટામાં થતો કોહવારો અટકાવી શકાય તથા પાકનો ઉગાવો સારો અને એક સરખો મેળવી શકાય.

● દવાની માપજત આપેલ રૂકડાને ૮-૧૦ કલાક ખુલ્લાં છાયામાં સુકવ્યા પછી જ વાવેતરમાં ઉપયોગ કરવો.

**વાવણી અંતર :**

બટાટાનું વાવેતર ૧૫ નવેમ્બરની આજુભાજુ કરવું હિતાવહ છે. વાવેતર અંતર જમીનનો પ્રકાર અને બટાટાની જાત ઉપર આધાર રાપે છે. બટાટાના બે ચાસ વર્ષે ૫૦ સે.મી. અને બે છોડ વર્ષે ૧૫ થી ૨૦ સે.મી. અંતર રાખી વાવેતર કરવું. સાંકડાં અંતરે વાવણી કરવાથી બટાટા લીલા થઈ જયા, કાટી વખતે કપાઈ જવાની શક્યતા રહે છે.

સામાન્ય રીતે બટાટાના વાવણી ખેડૂનો હળ અથવા ભાવટાથી કરે છે. કેટલાક ખેડૂનો ટ્રેક્ટર દ્વારા ચાલતા પ્લાન્ટથી પણ કરતા હોય છે. ભીની પદ્ધતિથી વાવેતર કરવું જેમાં પિચત આપી વરાપ થયે જમીન તૈયાર કરી નિકપાળા ચીરીને કરવાનું હોય છે.

## ખાતર :

જમીનની ફળદુપતા જળવાઈ રહે તે માટે હેકટરે ૪૫-૩૦ ટન કહ્યોવાચેલું છાણીયું ખાતર તથા એક ટન દિવેલીનો ખોળ જમીન તેથાર કરતી વખતે નાંખી ખોડ કરી જમીનમાં ભેગવી દેવું. વધુમાં ચોમાસામાં લીલો પડવાશ કરવો. બટાટાના પાકને ૨૭૫ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૧૩૮ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૨૭૫ કિ.ગ્રા. પોટાશ હેકટરે આપવાની ભલામણ કરવામાં આવેલ છે. જેમાં પાચાના ખાતરમાં ૧૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૧૩૮ કિ.ગ્રા. ફોસ્ફરસ અને ૨૭૫ કિ.ગ્રા. પોટાશ હેકટરે આપવું. આ માટે ૪૩૦ કિ.ગ્રા. એમોનિયમ સલ્ફેટ, ૩૦૦ કિ.ગ્રા.ડી.એ.પી. અને ૪૭૫ કિ.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશની એક હેકટરમાં જરૂર પડે.

ભલામણ કરેલ પાચાના ખાતરનો જથ્થો વાયેતર પહેલા ચાસમાં આપવો જેથી ખાતરનો કાર્યક્રમ ઉપયોગ થઈ શકે. રાસાયણિક ખાતર અને બટાટાના ટૂકડા વચ્ચે પ સે.મી. અંતર રહે તે રીતે ખાતર આપવું. પ્લાન્ટમાં એક હારનો પાળો અને બે હારનો પાળો એમ બે રીતે વાવણી કરી શકાય છે.

## પૂર્તિ ખાતર :

બટાટાના વાયેતર બાદ ૩૫-૪૦ દિવસે પાણા ચટાવતી વખતે બાકીનો ૧૩૫ કિ.ગ્રા. નાઈટ્રોજન (૨૬૩ કિલો સુરિયા) હેકટરે આપવું.

## પિયત :

નિકપાણા પદ્ધતિમાં પાળાનો ઉપરનો ભાગ કરો રહે તે રીતે પિયત આપવું. નિકપાણામાંથી પાળા ઉપર બીજી નીકમાં પાણી જાય તે રીતે પાણીના આપવું. ગોરાડું જમીનમાં ૮ થી ૧૦ દિવસના અંતરે કુલ ૮ થી ૧૦ પિયતની જરૂર પડે છે. રેતાળ જમીનમાં ૬ થી ૭ દિવસના અંતરે કુલ ૧૪ થી ૧૫ પિયતની જરૂર પડે છે.

બટાટાના પાકમાં ટપક પદ્ધતિથી પિયત આપવાની ભલામણ થયેલ છે. ટપક પદ્ધતિમાં દરેક ચાસમાં નળી ગોઠીની અને ૧૦ સે.મી. ના અંતરે પ્રતિ કલાકે ૪ લીટર પાણીનો જથ્થો ભલાર કાટતાં ટ્રીપર ગોઢવામાં આવે છે. ટપક પદ્ધતિથી ડીસેમ્બર-જાન્યુઆરી મહિનામાં ૪૫ મીનીટ અને ફેફુલારારી મહિનામાં ૬૮ મીનીટ એકાંતર દિવસે બટાટાના પાકને પાણી આપવું.

## અંતરખેડ અને નિંદામણ :

બટાટાના પાકમાં અસરકારક નિંદામણ નિયંત્રણ માટે મેટ્રોમ્યુઝીન દવા (સેન્કર) નિંદામણ ઊગા પહેલાં અથવા ઊગા પછી પિયત આપ્યા બાદ પુરતો ભેજ હોય ત્યારે ૧ હેકટરે ૪૦૦ ગ્રામ દવા ૫૦૦ લીટર પાણીમાં ભેગવી એક સરખો છંકાવ કરવો અથવા પેરાકવેટ (ગ્રામકગોન) ૨.૫ લીટર પ્રમાણે ૧૦૦૦ લીટર પાણીમાં બટાટાના પાકનો ૨ થી ૫ ટકા ઊગાવો થાય ત્યારે પહેલાં છંકાવ કરવો.

બટાટાએ મોડીફાઇઝ પ્રકાંડ છે. જેથી તેને સૂર્યપ્રકાશ મળતાં તે લીલા રંગનો થઈ જાય છે. તથા કંદના વર્ધન અટકી જાય છે તથા જો પાળો ચટાવવામાં ન આવે તો બટાટાના દાટા રૂપાંતર થઈ બટાટાની ડાળીના રૂપમાં વર્ધન પામે છે તેથી બટાટાના પાણા વ્યવસ્થિત કરવા જોઈશે.

## બટાટાના રોગો :

### ૧. બટાટાનો કોમન સ્કેલ:

આ રોગમાં છોડ ઉપર કોઈપણ પ્રકારના લખણો જોવા મળતા નથી. પરંતુ બટાટાના કંદ ઉપર રતાશ પડતા આછા મુખરા રંગના ગોળાકાર કાટખૂણા આકારના ઉપર્સી આવેલ અથવા દભાયેલ ભીંગાં જોવા મળે છે. જેથી બટાટાની ગુણવત્તા ખુલ જ ઘટી જાય છે.

## નિયંત્રણ :

- ઉપદ્રવ લાગેલ ખોટમાં ચોમાસામાં લીલો પડવાશ કરવો તેમજ ઉનાળામાં ડિકી ખોડ કરી જમીન તપાવવી.
- ઉપદ્રવ લાગેલ ખોટમાં પ્રતિ વર્ષે બટાટાનો પાક ન લેતાં પાકની કેરલદલી તરીકે રજકાનો કે ૨૭કા બાજરીનો પાક લેવો.
- રોગીએ ખોટમાં બટાટાને ટુંકા ગાળો પિયત આપી જમીન ભેજવાણી રાખવી.
- ખાતીવાળું રોગ મુકત નિયારણ વાપરવું અથવા પોતાના તેથાર કરેલ શુદ્ધ ભીજનો ઉપયોગ કરવો.
- શંકાસ્પદ નિયારણ વાપતા પહેલાં અથવા આગળના વર્ષ ખેતરમાં આ રોગ આવેલ હોય તો બોરીક એસીડના ૩ ટકાના કાવણમાં આખા કંદ ૩૦ મીનીટ બોળી, છાંચો સુકલ્યા બાદ ટૂકડા કરી વાયેતરમાં ઉપયોગમાં લેવું.
- બોરીક એસીડ કોમર્શિયલ ખાતીવાળો ૨૦ કિ.ગ્રા. /દે. ખાતર સાથે વાયેતર પહેલાં જમીનમાં આપી શકાય.

## ૨. આગોતરો સુકારો :

કુગાયી થતા આ રોગની શરૂઆતમાં છોડની નીચેના પાણ બદામી રંગના છુટા છવાચા લંબગોળ અથવા કાટમૂણા આકારના ટપકાં જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં આ ટપકાં જ્યારે વિકાસ પામે ત્યારે ઘાસીવાર તેમાં ચકની અંદર ચક જોવા મળે છે. અને રોગ દરેક પાણ ઉપર ફેલાઈ જાય છે.

### નિયંત્રણ :

મેટોપ્રોલ નામની કુગનાશક દવા ૨૫ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેણવી બટાટાના વાવેતર બાદ ૪૫ દિવસે પ્રથમ છંટકાપ કરવો. ત્યારબાદ ૧૦ થી ૧૫ દિવસના અંતરે એક છંટકાપ કરવો. હવામાન જ્યારે વાદળવાનું અથવા કમોસામી માવઢા જેણું હોય ત્યારે ખાસ છંટકાપ કરવો.

## ૩. પાછોતરો સુકારો :

રોગની શરૂઆતમાં ટોચના પાણ, દાંડી, પ્રકાં ઉપર જાંલુડીયા કાળા રંગના ટપકાં જોવા મળે છે. ખૂબ લેજવાણા હવામાનમાં રોગીએ પાનના ટપકાંની નીચેની બાજુએ સફેદ રંગની કુગાનો વિકાસ જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગૃતા વધતા પાક દારી ગાંધી હોય તેમ દેખાય છે. પાકમાં તીવ્ર વાસ આવે છે. મદ્ય ગુજરાત (ખેડા, વડોદરા) અને સોરાષ્ટ્રમાં આ રોગ જોવા મળે છે.

જેણા નિયંત્રણ માટે આગોતરા સુકારાના નિયંત્રણ મુજબ દવાનો છંટકાપ કરવો અથવા રોગની તીવ્રતા વધ્ય હોય તો મેરાલેક્સિલ (૧ ડિલો/હેકટરે) અથવા પ્રોપીનેલ (૧.૫ ડિલો/હેકટરે) પ્રમાણે ૧૦૦૦ લીટર પાણીમાં ઓગાણી છંટકાપ કરવો. આવા બે-પ્રણ છંટકાપ કરવાથી પણ પાછોતરા સુકારાનું ઘણું સાર નિયંત્રણ મળે છે. તદ્વિપરાંત આ રોગ સામે પ્રતિકારક શક્તિ ઘરાવણી કુફ્રી બાદશાહ, કુકરી જ્યાહર અને ટીપીએસ જાતનું વાવેતર કર્યું.

## ૪. રટેમ નેકોસીસ :

આ રોગના લીધે શરૂઆતમાં થડ ઉપર આછા બદામી રંગના ડાઘા પડી જાય છે જેણી ઉગૃતા વધતા ચાંદ મોટા થઈને પાનની દાંડી, ટોચ સુધી પ્રસરી જાય છે અને થડ કાળું પડી જાય છે. કેટલીકવાર થડ ભાંગી જરૂર છોડ સુકાવા લાગે છે. આ રોગના નિયંત્રણ માટે રોગની શરૂઆત જણાય તે વખતે મોનોકોટોફોસ અથવા મેટાસીસ્ટોક્ષ ગમે તે એક દવાનો ૧ મી.લી. પ્રતિ લીટર પાણી પ્રમાણે છંટકાપ કરવો. જો રોગને અનુકૂળ વાતાવરણ હોય તો ૧૫ દિવસના ગાંધે જીલા જે છંટકાપ કરવા હિતાવણ છે. સમયસર વાવેતર કરતા રોગનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે જ્યારે વહેલી વાવણીમાં વધારે મળે છે.

### બટાટાની જ્યાવાતો :

## ૧. થડ કાંઈ ખાનારી ઈયથ :

પાકની શરૂઆતની અવસ્થામાં છોડને જમીન સરખા કાંઈ નુકશાન કરે છે અને પાછલી અવસ્થામાં કંદ જેસે ત્યારે તેમાં દાખલ થઈ ગર્ભ ખાઈને ખોખાં બનાવી નુકશાન પહોંચાડે છે.

### નિયંત્રણ :

સાંજના સમયે પાણ અને થડ ઉપર એન્ડોસલ્ફાન ૧૨.૫ મી.લી. અથવા કાબર્સીલ ૨૦ ગ્રામ, કલોરપાયરીફોસ ૨૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં મિક્સ કરી છંટકાપ કરવો.

## ૨. પાના ખાનારી ઈયથ (હેલીયોથીસ) :

આ ઈયથ પાણ ખાઈને નુકશાન કરતી હોય છે, તે રોગ ભુખરા રંગની કે લીલા રંગની હોય છે.

### નિયંત્રણ :

આ ઈયથ જણાય કે તરત જ એન્ડોસલ્ફાન ૧૫ મી.લી. અથવા મોનોકોટોફોસ ૧૨.૫ મી.લી. અથવા કિવનાલફોસ ૨૦ મી.લી. પ્રમાણે દવા ૧૦ લીટર પાણીમાં ભેણવી છંટકાપ કરવો હેકટરે પાકની અવસ્થા પ્રમાણે ૧૦૦ થી ૧૦૦૦ લીટર જેટલા પાણીનો ઉપયોગ કરવો હિતાવણ છે.

## ૩. ચુસીયા પ્રકારની જ્યાવાતો (મોલો, તડતડીયા, સફેદ મશી) :

આ પ્રકારની જ્યાવાતો પાણ નીચે રહી રહી રસ ચુસી નુકશાન પહોંચાડે છે વધુમાં મોલો જેવી જ્યાવાત વિધાણુંથી થતા રોગો જેમકે, પથરંગીયો, કોકડવા વગોરેનો ફેલાવો કરવામાં વાહક તરીકે અગત્યના ભાગ ભજાયે છે.

### નિયંત્રણ :

ડાયમિથોએટ અથવા મીથાઈલ-ઓ-ડીમેટોન ૧૦ મી.લી. દવા ૧૦ લીટર પાણીમાં ભેણવી છંટકાપ કરવો. જરૂર પડે ૧૦-૧૫ દિવસના અંતરે જીલા જરૂરી છંટકાપ કરવાથી ચુસીયા પ્રકારની જ્યાવાતોને નિયંત્રણમાં રાખી શકાય છે.